

ત્વરિત જાહેરાત માટે

બ્રેમ્પટનને શહેરી ડિઝાઇન આયોજનમાં રાષ્ટ્રીય ઉત્કૃષ્ટતા માટે માન્યતા મળી

બ્રેમ્પટન, ઓન્ટેરિયો (એપ્રિલ 26, 2021) – સીટી ઓફ બ્રેમ્પટનને આયોજન અને પૃથક્કરણની શ્રેણીમાં [“અપટાઉન બ્રેમ્પટન ટ્રાન્ઝિટલક્ષી કમ્યુનિટીસ ટૂલકિટ”](#)ની પ્રસ્તુતિ કરવા બદલ ધી કેનેડિયન સોસાયટી ઓફ લેન્ડસ્કેપ આર્કિટેક્ચર (CSLA) પાસેથી [ઉત્કૃષ્ટતાનો એવોર્ડ](#) મળ્યો.

બ્રેમ્પટનની શહેરી ડિઝાઇન ટીમે પ્રોજેક્ટ વિકસાવવા ટોરોન્ટો સ્કૂલ ઓફ સીટીસ અને ધી અર્બન લેન્ડ ઇન્સ્ટિટ્યુટ ટોરોન્ટો ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલ સાથે ભાગીદારી કરી. “અપટાઉન બ્રેમ્પટનની ટ્રાન્ઝિટલક્ષી કમ્યુનિટીસ ટૂલકિટ” એવા સહયોગી શહેર-નિર્માણ મોડેલની શોધમાં છે જે જાહેર ક્ષેત્ર, ખાનગી ક્ષેત્ર, બિન-લાભકારી અને સ્થાનિક સમુદાયો વચ્ચે વધારે સારી એકરૂપતાને ટેકો આપે.

અપટાઉન મોડેલ “26-કલાકના શહેર”નું મૂલ્ય ઉઘાડું કરે છે, જ્યાં સમુદાયો 20-મિનિટમાં ચાલીને પહોંચી શકવાથી અવરજવર કરવાનો ઊંચો ખર્ચ અને કારની માલિકી રાખવાને ટાળે – દરરોજ “વધારાના કલાકો” પૂરા પાડે અને તેનાથી જીવનની ગુણવત્તા અને ઉત્પાદકતામાં સુધારો થાય. આ મોડેલ ઉચ્ચ-ગુણવત્તાની નોકરીઓ અને રોજગાર નિર્માણ માટે પણ સહાયરૂપ બને છે, અને શહેરને કાર્બન-તટસ્થ ભાવિ તરફ લઈ જવામાં મદદરૂપ થાય છે.

આ મહિને અગાઉ યોજાયેલા એવોર્ડ્સ સમારોહ દરમિયાન, ચૌદ પ્રોજેક્ટ્સને CSLA પાસેથી રાષ્ટ્રીય એવોર્ડ મળ્યો. આ એવોર્ડ-વિજેતા પ્રોજેક્ટ્સ આપણાં રહેવાના, કામ કરવાના અને રમવાના સ્થળોનો આકાર પુનઃઘડવા લેન્ડસ્કેપ આર્કિટેક્ચર દ્વારા કરવામાં આવતા કામો અને તેની શ્રેણી દર્શાવે છે.

લેન્ડસ્કેપ આર્કિટેક્ચરના રાષ્ટ્રીય પંચે (નેશનલ જૂરીએ) વિજેતાઓની પસંદગી કરી હતી. કુલ 72 રજૂઆતો મળી હતી. જૂરી સભ્યોએ લાગુ કરેલા માપદંડોમાં નીચેના માપદંડો સામેલ હતા:

- લેન્ડસ્કેપ આર્કિટેક્ચરની કળાની ગૂઢ સમજ અને રચના પ્રત્યે ધ્યાન અને વિગતોનું નિદર્શન;
- આગેવાની, પ્રોજેક્ટ મેનેજમેન્ટ, કામનો વ્યાપ, નવી દિશાઓ, કે નવી ટેકનોલોજીમાં ઉત્કૃષ્ટતાનું નિદર્શન;
- દૃઢ કલ્પના, પ્રક્રિયા, માલસામગ્રીઓ, કે અમલીકરણમાં નવીન શોધ;
- સંબંધિત ધંધાઓ, ગ્રાહકો, અને સામાન્ય જનતા વચ્ચે શિસ્તપાલનને પ્રોત્સાહન; અને,
- દાખલારૂપ પર્યાવરણલક્ષી અને/અથવા સામાજિક જગરૂકતાનું નિદર્શન.

અવતરણો (ક્વોટ્સ):

“બ્રેમ્પટન તકોને આગળ વધારતું એક વિચારશીલ શહેર છે અને અમે ગતિશીલ, આરોગ્યપ્રદ અને સંપૂર્ણ સમુદાય માટે સ્માર્ટ આયોજનના માર્ગ તરફ આગળ વધવા કટિબદ્ધ છીએ. હું સમુદાયોમાં 20-મિનિટમાં ચાલીને પહોંચી શકાય તેવી યોજનાઓ વિકસાવવાનું ચાલુ રાખવા માટે અને આપણે અપટાઉન બ્રેમ્પટનની સંભાવના ઉઘાડવાની રીત દેખાડવા માટે આપણી શહેરી ડિઝાઇન ટીમને વખાણું છું.”

- *પેટ્રિક બ્રાઉન (Patrick Brown), મેયર, સીટી ઓફ બ્રેમ્પટન*

“લ્યુરોન્ટેરિયો LRT નાં સ્ટીલ્સ સ્ટોપને મેટ્રોલિક્સ 2041 પ્રાદેશિક પરિવહન યોજના અને બ્રેમ્પટનની ઔપચારિક યોજનામાં ગેટવે મોબિલિટી હબ તરીકે નોંધવામાં આવ્યું છે. આ નિમણૂકથી ઉચ્ચ ગુણવત્તાવાળી ચાલવાની અને સાઈકલિંગ કરવાની માળખાગત સગવડો સહિત, ઉચ્ચ ધનતાવાળી વૃદ્ધિ અને પ્રવાસના બહુવિધ માધ્યમો માટે ડિઝાઇન વિચારણાઓને સહાયતા મળે છે. જો વૈશ્વિક મહામારીએ આપણને કંઈક

શીખવ્યું હોય તો તે બાબત એ છે કે આપણે બદલાતી વર્તાણકોને અનુકૂળ થવા તૈયાર રહેવું પડશે. અપટાઉનનું ટ્રાન્ઝિટલક્ષી સમુદાયમાં પરિવર્તન આપણાં રહેવાસીઓ, ધંધાઓ અને સ્થાનિક હિતધારકો માટે પરિપૂર્ણ સમજ ઊભી કરે છે.”

- માર્ટિન મેડેરોસ (Martin Medeiros), રીજીયનલ કાઉન્સિલર, વોર્ડ્સ 3 અને 4; પ્રમુખ, આયોજન અને વિકાસ, સીટી ઓફ બ્રેમ્પટન

“શહેરમાં, અમે રહેવા યોગ્ય, આરોગ્યપ્રદ અને સંપૂર્ણ સમુદાયો માટે એવા આયોજનમાં સમર્પિત છીએ જે આપણાં રહેવાસીઓના મૌલિક વિચારો અને જરૂરિયાતોને પ્રતિબિંબિત કરે. આ પ્રતિષ્ઠિત એવોર્ડ મળવા બદલ આપણી શહેરી ડિઝાઇનની ટીમને અભિનંદન. અપટાઉનમાં શોપર્સ વર્લ્ડનું સ્થળ બ્રેમ્પટનના આ વિસ્તારને ટ્રાન્ઝિટલક્ષી સમુદાય તરીકે વિકસાવવામાં રોકાણ આગળ વધારવાની અજોડ તક પૂરી પાડે છે.”

- ડેવિડ બારિક (David Barrick), ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર, સીટી ઓફ બ્રેમ્પટન

-30-

કેનેડાના સૌથી ઝડપી વિકાસ કરતા શહેરો પૈકી એક તરીકે બ્રેમ્પટનમાં 7,00,000 કરતા વધુ લોકો વસે છે અને તેમાં 75,000 વ્યવસાયો છે. અમે જે કંઈ કરીએ છીએ તેનો હાર્દ છે લોકો. અમને ઊર્જા મળે છે અમારા વિવિધ સમાજોમાંથી, અમે રોકાણ માટે આકર્ષણનું કેન્દ્ર છીએ અને અમે તકનિકી અને પર્યાવરણીય નવિનતા તરફ દોરી જતી યાત્રાનું નેતૃત્વ કરીએ છીએ. અમારી ભાગીદારી એવા નિરોગી શહેરના વિકાસ માટે છે જે સુરક્ષિત, ટકાઉ અને સફળ હોય. અમારી સાથે [Twitter](#), [Facebook](#), અને [Instagram](#) પર જોડાવ. વધુ જાણવા માટે www.brampton.ca.

મિડિયા સંપર્ક :

મોનિકા ડુગ્ગલ (Monika Duggal)

કોઓર્ડિનેટર, મિડિયા એન્ડ કમ્યુનિટી એંગેજમેન્ટ

વ્યૂહાત્મક સંવાદ

સીટી ઓફ બ્રેમ્પટન

905-874-3426 | Monika.Duggal@brampton.ca